

આઇસીએઆર-સીબા એક્સ્પોર્ટેશન સિરીજ નંબર. ૭૨.



## માઇલી અને ગ્રીંગનું આદર્શ બધુપાલન મોડેલ : ગુજરાત રાજ્યનો અભિગામ

(દ્રાબલ સબપ્લાન અંત્રગત)

તનવીર હુસેન, જોસ એન્ટની, પી.એ. પાટિલ,  
બીજુ આઈ.એફ., પી. મહાલક્ષ્મી,  
સી.પી.બાલાસુબ્રમણ્યમ,  
એમ.કેલાસમ, કે.કે. વિજયન



સીઆઇબીએ- નવસારી ગુજરાત સંશોધન કેન્દ્ર  
(ભારતીય કૃષિ સંશોધન પરિષદ)  
પ્રથમ માળ પશુપાલન પોલીટેકનિક, નવસારી કૃષિ યુનિવર્સિટી,  
એરુ ચાર રસ્તા, નવસારી ૩૯૬૪૫૦, ભારત

# માઇલી અને ગ્રીંગાનું આદર્શ બહૃપાલન મોડેલ : ગુજરાત રાજ્યનો અભિગામ

(દ્રાબિલ સબપ્લાન અંત્રગત)

તનવીર હુસેન, જોસ એન્ટની, પી.એ. પાટિલ, બીજુ આઈ.એફ.,  
પી. મહાલક્ષ્મી, સી.પી. બાલાસુખુમણ્યમ,  
એમ.કૈલાસમ, કે.કે. વિજયન



સીબા- નવસારી ગુજરાત સંશોધન કેન્દ્ર  
(ભારતીય કૃષિ સંશોધન પરિષદ)  
પ્રથમ માળ પશુપાલન પોલીટેકનિક, નવસારી કૃષિ યુનિવર્સિટી,  
એરુ ચાર રસ્તા, નવસારી ૩૮૬ ૪૫૦, ભારત

ફેબ્રુઆરી ૨૦૨૦



માધ્યલી અને ઝીંગાનું આદર્શ બહુપાલન મોડેલ :  
ગુજરાત રાજ્યનો અભિગમ



### પ્રકાશિત

ડૉ. કે. કે. વિજયન  
નિયામક, આઇસીએઆર-સીબા

### દ્વારા તૈયાર

તનવીર હુસેન  
જોસ એન્ટની  
પી.એ.પાટિલ  
બીજુ આઈ.એફ.  
પૂ. મહાલક્ષ્મી  
સી.પી. બાલાસુબ્રમણ્યમ  
એમ. કૈલાસમ  
અંબાસંકર કે.  
વિજયન કે.

ફેબ્રુઆરી, ૨૦૨૦

આઇસીએઆર-સીબા એક્સ્ટેશન સિરીઝ નંબર. ૭૨.

### પ્રશંસાપત્ર

હુસેન, ટી., એન્ટની, જી., પાટિલ, પી.એ., મહાલક્ષ્મી, પી., બીજુ, આઈ.એફ., બાલાસુબ્રમણ્યમ, સી.પી.,  
કૈલાસમ, એમ., અંબાસંકર, કે. અને વિજયન, કે.કે., ૨૦૨૦. માધ્યલી અને ઝીંગાનું આદર્શ  
બહુપાલન મોડેલ : ગુજરાત રાજ્યનો અભિગમ. આઇસીએઆર-સીબા એક્સ્ટેશન સિરીઝ નંબર.  
૭૨. આઇસીએઆર-સીબા, ચેન્નાઈ. પીપી 28.



પોલિકલ્યર એ બે અથવા વધુ જાતિના ફિનફિશ અથવા શેલફિશનો ઉછેર છે અને એ જ ઉછેર પદ્ધતિમાં પ્રજાતિઓનું સંયોજન તેમના ખોરાકની વર્તણૂક, પર્યાવરણીય વિશિષ્ટતા, સુસંગતતા અને ખેડૂતની આવક વધારવાના આધારે બનાવવામાં આવે છે. પોલિકલ્યર કોઈપણ પ્રકારના ઉછેર માટે ટકાઉ મોડેલ તરીકે વ્યાપકપણે વખાણાય છે. માઇલી, ઝીંગા અને કાદવ કરચલાઓનું પોલિકલ્યર, ભાંભરા પાણીનાં જળચર ઉદ્યોગમાં ટકાઉ ઉછેરના નમૂના તરીકે સ્વીકારવામાં આવ્યું છે. મોટાભાગના દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયામાં મિલ્કફિશ સાથે ઝીંગાનું પોલિકલ્યર એ એક સામાન્ય પોલિકલ્યર પદ્ધતિ છે જેમાં બંને જાતિઓને પરસ્પર લાભ થાય છે અને ખેડૂત વધુ ઉત્પાદન અને નફા કારકતા પ્રાપ્ત કરવા માટે સક્ષમ બને છે. મિલ્કફિશ ઝીંગા પોલિકલ્યર ઉછેર પદ્ધતિમાં, મિલ્કફિશગ્રેન વોટરની પ્રણાલીને પ્રોત્સાહન આપીને પાણીની ગુણવત્તાની સંભાળ રાખે છે, જેમાં રોગકારક બેક્ટેરીયલ ભાર ઓછો હોય છે, સિસ્ટમમાં કાર્બનિક પદાર્થોના લોડિંગને રોકવા માટે વધારાનો અથવા બાકી રહેલો ખોરાક ખાય છે, તથા ઉચ્ચ મુલ્યવાળા ઝીંગા ઉછેરવા માટે આદર્શ વાતાવરણ પ્રદાન કરે છે. એ જ રીતે, મિલ્કફિશ અથવા અન્ય શાકાહારી / સર્વભક્ષી ભાંભરા પાણીની ફિનફિશ સાથે કાદવ કરચલાઓનું બહુપાલન સ્વીકૃત મોડેલ પણ છે. કરચલાઓ તજિયામાં વસતા પ્રાણીઓ હોવાના કારણે તળાવના તજિયાનો ઉપયોગ કરવામાં આવતો હતો અને પાણીની કોલમ માઇલીને ઉછેરવા માટે વાપરી શકાય છે. મોટાભાગના પોલિકલ્યર મોડેલોમાં, કેટલીક જાતિઓને કાં તો ખવડાવવામાં આવતી નથી અથવા ફક્ત અંશત ખવડાવવામાં આવે છે અને સંપૂર્ણ પૂરક ખોરાક અન્ય પ્રજાતિઓમાં પ્રસારિત કરવામાં આવે છે. ભાંભરાપાણીના જળચરઉછેરના પોલિકલ્યર મોડેલોને ખર્ચ અસરકારક ઉછેર પદ્ધતિ તરીકે પણ ગાણવામાં આવે છે જેમાં બે પ્રજાતિઓ દ્વારા સમાન રૂપે ઉપયોગમાં લેવામાં આવતી ઓછી કિમતવાળો ખોરાક ઉછેર પદ્ધતિને પણ લાગુકરી શકાય છે. ભાંભરા પાણીના જળચર ઉછેરમાં પોલિકલ્યર ઉછેર પદ્ધતિને દરિયાકાંઠાના આદિજાતિ સમુદ્દરાયોની આજીવિકા વધારવા માટે એક ઉત્તમ તક છે.



માછલી અને ઝીંગાનું આદર્શ બહુપાલન મોડેલ :  
ગુજરાત રાજ્યનો અમિગમ



## મિલ્કફિશ, ચાનોસચાનોસ

ભાંભરા પાણીની ડિનક્ષિશ, મિલ્કફિશ ચાનોસચાનોસને તેના ઝડપી વિકાસ દર (૬ મહિનામાં ૫૦૦ ગ્રામ), સખત પ્રકૃતિ અને ઉત્પાદનની ઓછી કિંમત ને કારણે તળાવ અને પેન આધારિત જળચર ઉછેર માટેની એક સંભવિત ઉમેદવાર પ્રજાતિ તરીકે ગણવામાં આવેછે. યુરીહેલાઈન અને તૃણહારી માછલી હોવાને કારણે તેબેન્દિકશેવાળલેબ-લેબ, ફાયટોપ્લેંક્ટોન અને ડાયુન્ડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તે ઉછેર પ્રણાલીમાં ઓછો પ્રોટીન પેલેટેડ ખોરાક સ્વીકારે છે અને ૦ થી ૫૦ પીપીટી સુધીની ખારાશને સહન કરે છે. મિલ્કફિશ ઉછેરમાં ઓછા રોકાણ ની જરૂરપડે છે અને તે દરિયાકાંઠાના પ્રદેશોમાં આદિવાસી સમુદાયો માટે આજીવિકાના વિકલ્પ ઉત્પન્ન કરેછે. મિલ્કફિશનો સ્થાનિક બજારમાં ભાવ રૂ. ૧૫૦-૧૮૦ / કિગ્રાછે જ્યારે ઉત્પાદન ખર્ચ માત્ર રૂ. ૫૦-૬૦ / કિગ્રા છે.



મિલ્કફિશ

## મિલ્કફિશનું બહુપાલન

ઝીંગા, કાદવકરચલા અને માછલીની અન્ય પ્રજાતિ ઓ સાથે મિલ્ક ફિશનો પણ ઉછેરકરી શકાય છે. જો કે, ઝીંગા અથવા કાદવકરચલા સાથે મિલ્કફિશ નો ઉછેર એ સૌથી લોક પ્રિય અને નફાકારક સંયોજન છે. અહેવાલ છે કે મિલ્ક ફિશ ઝીંગા તળાવના તજિયે ભેગા યેલા ઓરગેનિક પદાર્થોનો સંગ્રહ કરી શકે છે અને ત્યાંથી કચરા સંચય સાફક રીશકે છે અને ગ્રીન વોટરની



વ્યવસ્થા જળવી શકેછે, ઝીંગાના વિકાસમાં મદદ કરે છે. આ પ્રથાદ ક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ખૂબ જ પ્રખ્યાત છે અને આ પ્રથા ભારતમાં ઝીંગા ખેડૂતો માં પ્રચલિત થઈ રહીછે. મિલ્કફિશનું ઉત્પાદન ૧૨૦૦ થી ૧૮૦૦ કિગ્રા / હેક્ટર પ્રાથમિક પાક તરીકે થાય છે જ્યારે ઝીંગા સાથે મળી ને ઉછેરવામાં આવે છે ત્યારે ઝીંગાનું ઉત્પાદન ૧૦૦ - ૨૦૦ કિગ્રા / હેક્ટર / ઉછેરનું હોય છે. પોલિકલ્યર પદ્ધતિની મદદ થી આશરે ૫૫૦કિગ્રા / હેક્ટર મિલ્કફિશ અને ૧૫૦ કિગ્રા / હેક્ટર કરચલાનું ઉત્પાદન મેળવી શકાય છે.

### ભારતીય સફેદ ઝીંગા અને મિલ્કફિશની પોલીકલ્યર

મિલ્કફિશ સાથે ભારતીય સફેદ ઝીંગાનું પોલિકલ્યર, ટકાઉ અને આણિક રીતે વ્યવસ્થિત ઉછેર પદ્ધતિ માનવામાં આવે છે. મિલ્કફિશનો ઉપયોગ ઉત્પાદનની કિંમત ઘટાડવા માટે ઝીંગાની સાથે ગૌણ ઉછેર તરીકે થઈ શકે છે. અને, ઉપરાંત મિલ્કફિશને એક અયોગ્ય ઇલોફેઝિક ખોરાકની ટેવ છે, તે વધુ પડતા ઓરગેનિક પદાર્થોનો વપરાશ કરે છે, ઓગાળેલા પોષક તત્વોને ઘટાડે છે, પાણીની ગુણવત્તામાં સુધારો કરે છે અને રોગકારક સૂક્ષ્મજીવો સામે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. એનજીઆરસી-સીબાએ મટવાડ ગામ, નવસારી ગુજરાત ખાતેના ફાર્મમાં ૨૦૦૦ એકમ તળાવમાં મિલ્કફિશની સાથે ભારતીય સફેદ ઝીંગાના પોલીકલ્યરનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

### જમીનની પસંદગી

કોઈપણ જળચર ઉછેરની સફળતા માટે જમીનની પસંદગી એ મહત્વ પૂર્ણ પ્રક્રિયા છે. પસંદ કરેલી જમીનમાં રસ્તાઓ, હેચરીઓ તથા વીજળી અને સંદેશા વ્યવહાર ની સારી ઉપલબ્ધતા હોવી જોઈએ. સ્થાનિક ડેનેજ અને ઔદ્યોગિક પ્રવાહો દ્વારા જમીન પ્રદૂષણથી મુક્ત હોવું જોઈએ. પસંદ કરેલી જમીનમાં કાદવવાળી કડક માટી હોવી જોઈએ. ઝીંગાના જેતરોના નિર્માણ માટે જમીનની યોગ્ય લાક્ષણિકતા નીચે મુજબ છે.



માટીની ગુણવત્તાના પરિમાણો	
પીએચ	૭-૮
ઓરગેનિક કકર્બન	૧.૫-૨.૫%
કેલ્થિયમ કાર્બોનેટ	>૫%
ઉપલબ્ધ ઇન્ફ્રાઝિસ્ટ્રક્ચર	૫૦-૭૫ મીલી ગ્રામ
ઉપલબ્ધ ફોસ્ફરસ	૪-૬ મીલી ગ્રામ / ૧૦૦ ગ્રામ માટી
વિદ્યુત વાહકતા	>૪૫૫૦ વ્હો / સેમી

### તળાવની તૈયારી

તળાવ ની તળિયા તૂટી જાય ત્યાં સુધી સૂકવણી સાથે તળાવની તૈયારી શરૂક રવી. માઇક્રો બાયલસડો અને ઓરગેનિક પદાર્થોના ખનિજ કરણ માટે તડકા માં સૂકવણી ઓછામાં ઓછા ૩ અઠવાડિયા સુધી કરવી જોઈએ. એડીને તળિયા સુધીની માટી વાતાવરણમાં બહાર કાઢવાથી જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે પરિણામે ઓક્સિડેશન થાય છે અને જમીનમાં ના પોષક તત્વો મુક્ત થાય છે. માટીમાં ચૂનાના છંટકાવ જેવી માટી વ્યવસ્થાપન પદ્ધતિઓ નું પાલન કરવું આવશ્યક છે. ચૂનાની મૂળભૂત માત્રા ૩૦૦-૫૦૦ કિગ્રા / હેક્ટરની હોવી જોઈએ. જો જમીનનું પીએચ < ૭.૫ ન હોય તો જમીન નું પીએચ એસિડિક હોય. ઉપયોગમાં લેવા માટેનો ચૂના નો જથ્થો જમીનના પીએચ અને ચૂનાના જથ્થાની સામગ્રી પર આધારીત છે.



તળાવની તળિયે ની માટી એડવી



### પાણીનું સેવન અને જીવાણું ના કક્ષિયા

પાણીના સોત તરીકે કીક, બેકવોટર, ઈચ્છુયરી અથવા સમુક્રનો ઉપયોગ થઈ શકે છે. યોગ્ય જળી સાથે પંપ અથવા સ્લુઇસ ગેટનો ઉપયોગક રીને પાણી ખેંચી શકાય છે. અનિચ્છનીય શિકારી જીવ અને નકામા પ્રદાનોને દૂર કરવા માટે ઝીણી જળીનો ઉપયોગક રીને સોત પાણીને ફિલ્ટર કરવું જોઈએ. પાણી સીધા તળાવમાં ન લેવું જોઈએ. પ્રથમ, સોત પાણીમાં સ્થગિત કણોને સ્થાયી થવાદેવા માટે, તેને ટાંકીમાં સ્થાનાંતરિત કરવું જોઈએ, ત્યાર બાદ તેને ૧૫૦-૨૫૦ માઈકોનની શ્રેણી બધ્ય જળીદારા જળાશય સુધી પહોંચાડવું જોઈએ. સંભવિત પેથોજન્સ અને વાહકો દૂર કરવા માટે કેલ્શિયમ હાયપોક્લોરાઇટ @ ૧૦ પી.પી.એમ. ના ઉપયોગ દ્વારા પાણીની જીવાણું નાશકક્ષિયા કરી શકાય છે. વધારાના કલોરીનને જળાશયોમાંથી દૂર કરવા માટેની પ્રક્રિયા ૫-૭ દિવસ સુધીની હોય છે. ડિક્લોરિનેટેડ પાણીને ઉછેર તળાવમાં લેવામાં આવે છે. ઝીંગા અને મિલ્કફિશના પોલિકલ્યર માટે ના મહત્તમ પાણીની ગુણવત્તા ના પરિમાણો નીચે મુજબ છે:-

પાણીની ગુણવત્તાના પરિમાણો	
તાપમાન (૦સે)	૨૮-૩૩
પારદર્શિતા (સે.મી.)	૨૫-૪૫
પીએચ	૭.૫-૮.૫
ઓગાલ ઓક્સિજન (પીપીએમ)	૫-૭
ખારાશ (ppt)	૧૫-૨૫
કુલ ક્ષારીયતા (પીપીએમ)	૨૦૦
ઓગાલા (પીપીએમ)	૦.૧-૦.૨
નાઇટ્રો-N (પીપીએમ)	<૦.૦૩
નાઇટ્રોઇટ-ન (પીપીએમ)	<૦.૦૧
એમોનિયા - એન (પીપીએમ)	<૦.૦૧



માધ્યલી અને ઝીંગાનું આદર્શ બહુપાલન મોડેલ :  
ગુજરાત રાજ્યનો અમિંગમ



તળાવના પાણીની જીવાણું નાશક કિયા (જંતુ નાશક એજન્ટની અરજી)

### તળાવની ફળકૃપતા :-

તળાવમાં ફાયટોપ્લેન્કટોન અને ઝૂપ્લેન્કટોનની સ્વસ્થ બ્લૂમ મેળવવા માટે ખાતરોનો ઉપયોગ કરવો આવશ્યક છે. ઝીંગાના ઉછેરમાં પ્રારંભિક લાર્વલ તબક્કા માટે જૈવિક અને અજૈવિક બંને ખાતરોનો ઉપયોગ કરી શકાય છે. ખાતરનો ઉપયોગ નવી સ્ટોક કરેલી પોસ્ટ લાર્વા માટે પ્રાકૃતિક ખોરાકના જીવતંત્રને વધારવામાં મદદ કરે છે. મોલાસેસનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થઈ શકે છે જે ફાયદાકારક બેકટેરિયાના વિકાસને વેગ આપે છે અને તળાવમાં એમોનિયા અને નાઇટ્રોએન્ટનું પ્રમાણ ઘટાડે છે. મોલાસેસનો ઉપયોગ ૫૦-૧૦૦ કિગ્રા પ્રતિ હેક્ટરના દરે કરી શકાય છે. રાઈસ બ્રાનનો ઉપયોગ ૨૫૦-૪૦૦ કિગ્રા / હેક્ટરના દરે કરી શકાય છે. યુરિયા અને ડાય-એમોનિયમ ફોસ્ફેટ / સિંગલ સુપર ફોસ્ફેટ જેવા અજૈવિક ખાતરોનો ૧ : ૧ ડોઝ ૨૦ કિગ્રા / એકરના દરે લાગુ કરી શકાય છે.



## ભારતીય સફેદ ઝીંગા અને મિલ્કફિશનો સંગ્રહ અને અનુકૂલન

ગુણવત્તાયુક્ત અને સ્વસ્થ પિનિયસ ઇન્ડિક્સ બીજ કોઈપણ પ્રતિષ્ઠિત CAA માન્ય કરેલ હેચરી પાસેથી મેળવી શકાય છે. ગુણવત્તાયુક્ત બીજનો ઉપયોગ અસ્તિત્વ ટકાવી રાખવા અને સારી વૃક્ષ પર સીધો સંબંધ ધરાવે છે. બીજની નોંધણી અગાઉથી સારી રીતે કરાવવી જોઈએ જેથી લાર્વા ઉછેરની સંપૂર્ણ પ્રક્રિયાનું અવલોકન કરી શકાય અને બીજ પરીક્ષણ કોઈપણ તબક્કે કરી શકાય. ખારાશની અનુકૂલતા હેચરીમાં જ કરી શકાય છે. પોસ્ટ લાર્વાનું (પીએલ ૧૫) ન્યૂનતમ તળાવવાળી જગ્યા પર પરિવહન થવું જોઈએ. થમોકોલ બોક્સમાં મૂકવામાં આવેલી પોલિથીન બેગમાં અથવા મોટી બંધ ટાંકીમાં સતત ઓક્સિજન સપ્લાય સાથે બિયારણનું પરિવહન કરી શકાય છે. આગમન સમયે, લાર્વાને તળાવની પાણીની સ્થિતિ, જેમ કે તાપમાન, પીએચ, ખારાશ સાથે અનુકૂલિત કરવું જોઈએ, જેથી સ્ટોકિંગ પહેલાં તનાવ અને આંચકો ન આવે. વહેલી સવારે અથવા સાંજે ઠંડા કલાકો દરમિયાન સ્ટોકિંગ કરવું જોઈએ. સ્ટોકિંગ દરમિયાન, તાપમાનમાં વધારાને અનુકૂલિત કરવા, તળાવમાં લગભગ ૩૦ મિનિટ સુધી, બિયારણ પોલિથીન બેગ તરતા મૂકીને, તળાવનું પાણી સમાન પ્રમાણમાં, ૩૦ મિનિટ સુધી પોલિથીન બેગમાં ભેણવીને કરી શકાય છે. ઝીંગા બીજને ૧૭-૧૮ નંબર / એકમના દરે સ્ટોક કરવા જોઈએ. ઝીંગાના કલ્યરના ૪૫-૩૦ દિવસ પછી, ૮-૧૨ સે.મી. કદની મિલ્કફિના ફિગરલીંગસને તળાવમાં છોડી શકાય. મિલ્કફિશનું ૦.૫ નંબર/ એકમના દરે સ્ટોકિંગ કરવું જોઈએ.



પી ઇન્ડિક્સ પોસ્ટ લાર્વા



માધ્યલી અને ઝીંગાનું આદર્શ બહુપાલન મોડેલ :  
ગુજરાત રાજ્યનો અમિંગમ



પી ઈન્ડિક્સના ૪૫ ડીઓસી પછી મિલ્કફિશ ફિંગરલિંગ્સ ૮-૧૨ સે.મી

### એરેશન

ઝીંગા તળાવમાં ઓગળેલા ઓક્સિજનને જટિલ ગુણવત્તાવાળા પરિમાણ તરીકે ગણવામાં આવે છે. જૈવિક પદાર્થોનું વિધટન, અચાનક પ્લેન્કટોન કેશ, ગરમ હવામાન અને વાદળછાયું વાતાવરણ તળાવોમાં ઓગળેલા ઓક્સિજનના ઘટાડામાં પરિણામે છે. વહેલી સવારના કલાકો દરમિયાન ઝીંગા તળાવોમાં વાયુ ઉત્પઞ્ચ થવું આવશ્યક છે જ્યારે ડીઓ ન્યુનતમ રહેશે. પેડલ વ્હીલ એરેટર્સ એ સામાન્ય પ્રકારની સપાટીના વાયુયુક્ત પદાર્થો છે જે ઝીંગા તળાવોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. પેડલ વ્હીલ એરેટર્સ ઓક્સિજન ટ્રાન્સફર કાર્યક્ષમતા લગભગ ૧.૭ કિગ્રા / કેડબલ્યુ છે. સામાન્ય રીતે, ૪-૫ નંગા / હેક્ટર પેડલ વ્હીલ એરેટર્સનો ઉપયોગ ઝીંગા તળાવોમાં સ્થાયી બાયોમાસ મુજબ થાય છે અને @ ૧ એચ્પી એરેટરનો ઉપયોગ ઝીંગાના ૫૦૦ કિલો બાયોમાસ માટે થઈ શકે છે. વહેલી સવારના કલાકો દરમિયાન સવારે ૩ થી સવારે ૭ વાગ્યા સુધી એરેશન આપવું આવશ્યક છે. તળાવની અંદરના પાણીના પ્રવાહને ઘટાડવા એરેટર્સની યોગ્ય સ્થિતિમાં ગોઠવણી કરવી જોઈએ.



પોલીકલ્યર તળાવમાં પેડલ વીલ એરેટર

### ફીડ અને ફીડિંગ મેનેજમેન્ટ

પી ઇન્ડિક્સને વ્યાપારિક ફોર્મ્યુલેટેડ ખોરાક પૂરો પાડી શકાય છે. ખોરાક ત્રણ જુદા જુદા ગ્રેડમાં ઉપલબ્ધ છે જેમ કે સ્ટાર્ટર ૦.૨-૧ મીમી નાના, ઉત્પાદક ૧.૮-૨.૩ મીમી પેલેટ અને ડિનિશાર ૨.૩ -૨.૫ એમએમ પેલેટ. આ ખોરક વધતા જતા ઝીંગાના વિવિધ કદના જીથને અનુકૂળ છે. આઇ.સી.એ.આર.-સીબા વેનામી પ્લસ-કોસ્ટ ઇફેક્ટિવ ફીડ પી વેનામેની ઉછેર માટે વિકસિત કરી છે. વધુ સારા ઉત્પાદન માટે વેનામી પ્લસ ફીડનો ઉપયોગ પી ઇન્ડિક્સને ખવડાવવા માટે પણ થઈ શકે છે. ઈનિક ખોરાકની ગણતરી કલ્યર તળાવના બાયોમાસના આધારે કરવામાં આવે છે. કલ્યરના પ્રારંભિક તબક્કા દરમિયાન, ઝીંગાના શરીરના વજનનાં ૧૫-૨૦%ના દરે ખોરાક આપવામાં આવે છે. ઝીંગાની વૃદ્ધિ સાથે, તે ધીમે ધીમે ઘટતો જાય છે અને ઉછેરના અંત સુધી ૨-૩ % ની નીચે આવે છે. દરરોજ ખોરાક ૩-૪ કલાકના અંતરાલમાં આપવું જોઈએ. ખોરાકનું સંચાલન ચેક ટ્રેમાના ખોરાકના વપરાશને ધ્યાને રાખીને કરવું આવશ્યક છે. ગંદકી અને તણાવપૂર્ણ પરિસ્થિતિ દરમિયાન, પ્રમાણયુક્ત ખોરાક અપનાવવો જોઈએ. મિલ્કફિશના વજનના ૨%ના દરે ઓછી કિંમતનો ખોરાક પોલિપ્લસનો ઉપયોગ કરીને મિલ્કફિશને ખવડાવી શકાય છે.



માધ્યલી અને ઝીંગાનું આદર્શ બહુપાલન મોડેલ :  
ગુજરાત રાજ્યનો અમિગમ



તપાસો ટ્રે: - ખોરાકના ઉપયોગની દેખરેખ

### બાયોસેક્યુરિટી

ઝીંગા ઉછેરની સફળતામાં બાયોસાયક્યુરિટી એ મુખ્ય તત્વ છે. વાયરલ અને અન્ય રોગના સંકમણને રોકવા માટે બાયોસેક્યુરિટી પગલાં લેવામાં આવે છે. બહારના વાહનોના પ્રવેશ માટે પ્રતિબંધ મૂકવો જોઈએ અથવા ટાયર ડીપની સાવચેતીનું પાલન કરવું જોઈએ. વાહકોના પ્રવેશને ટાળવા માટે સોત પાણીનું યોગ્ય ફિલ્ટર વાપરવું જોઈએ. જળાશયોમાં પાણીની જીવાણું નાશકકિયાને અનુસરવું જોઈએ. પક્ષીઓની ફેન્સીંગ ક્રારા સ્કર્સ પક્ષીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવા જોઈએ, આડા ટ્રાન્સમિશનને ટાળવા માટે, કોઈપણ તળાવમાં ઉપયોગ કરતા પહેલા પોટેશિયમ પરમેંગેનેટના સોલ્ટ્યુશનમાં જાળી અને અન્ય સામગ્રીની જીવાણું નાશકકિયા કરવી જોઈએ.



## લણણી અને માર્કેટિંગ

લણણી તળાવના પાણીને પમ્પ દ્વારા કાઢીને કરી શકાય છે અને ત્યારબાદ તળાવમાં રહેલા ઝીંગાને હાથથી વીણવામાં આવે છે. લણણી કરેલા ઝીંગાને શુધ્ધ પાણીમાં ધોવા જોઈએ અને ઠંડી પરિસ્થિતિમાં મારી નાંખવા જોઈએ અને લણણી પછી તરત જ આઇસિંગ પ્રક્રિયા કરવામાં આવે છે. ખરીદારો ફાર્મ સાઇટ પરથી ઝીંગા એકત્રિત કરે છે અને રેફિજરેટેડ વાનમાં વહન કરે છે. મિલ્કફિશની લણણી અને તેનું વેચાણ 300-400 ગ્રામના વજનમાં થઈ શકે છે જેમાં કુલ લંબાઈ 20-40 સે.મી હોય છે. 300 ગ્રામ કે તેથી વધુ વજનની એકસરખી રીતે ઉછેરેતી મિલ્કફિશની અંશતઃ લણણી ડ્રેગનેટ્સ અથવા ગીલનેટની મદદથી કરવામાં આવે છે. મિલ્કફિશની વિવિધ પક્ષતિઓ દ્વારા પણ લણણી કરી શકાય છે જેમ કે ગુરુત્વાકર્ષણ અથવા પંપ દ્વારા તળાવને દ્વારા સંપૂર્ણ ખાલી કરીને, જાળીનાં પાંજરા જેવી રચના દ્વારા, પેનમાં સેઈન અથવા ગીલનેટના ઉપયોગ દ્વારા. મિલ્કફિશના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સારા ભાવ મળે છે. ભારતના ઘરેલું બજારમાં, મિલ્કફિશ 150-200 રૂપિયા / કિલોગ્રામ ના ભાવે મળે છે.



મિલ્કફિશની લણણી



માધ્યલી અને ઝીંગાનું આદર્શ બહુપાલન મોડેલ :  
ગુજરાત રાજ્યનો અમિગમ



### ઉત્પાદન અને અર્થશાસ્ત્ર

ભારતીય સફેદ ઝીંગા અને મિલ્કફિશના પોલિકલ્વર એ એક ટકાઉ ઉછેરનું મોડેલ છે. ૨૦૦૦ એકમ તળાવમાં ૩૫૦૦૦ પી ઇન્ડિક્સ અને ૬૦૦ નંગા મિલ્કફિશ ફિંગરલિંગ્સ સ્ટોક કરવામાં આવ્યા હતા. ૪૫૦-૫૦૦ કિલો પી ઇન્ડિક્સ અને ૨૦૦ કિલો મિલ્કફિશનું ઉત્પાદન સરળતાથી પ્રાપ્ત થાય છે. આ આશરે રૂ. ૮૫,૦૦૦ પાકનો ચોખ્મો લાભ રૂ. ૮૫૦૦૦ થી રૂ. ૧.૦૫ લાભ હશે. અંદાજિત ઉત્પાદકતા પ્રતિ હેક્ટર @ ૩.૫ ટન હશે.



પોલીકલ્વર તળાવમાંથી મિલ્કફિશનું પાક



પોલીકલ્યર તળાવમાંથી પી ઇન્ડીક્સનો પાક



માછલી અને જીંગાનું આદર્શ બહુપાલન મોડેલ :  
ગુજરાત રાજ્યનો અમિંગમ



## મિલ્જફિશ માઇલી સાથે કાદવના કરચલાનું બહુપાલન

સીયલા જતિના કાદવ કરચલાનો સમગ્ર દક્ષિણ પૂર્વ અને દક્ષિણ એશિયામાં મોટા પ્રમાણમાં ઉછેર કરવામાં આવે છે. ભારતમાં વ્યાપારી કાદવ કરચલાનો જળચરાંછેર એ એક ઉભરતી આર્થિક પ્રવૃત્તિ છે અને ભારતીય ઝીંગા ઉદ્યોગ દ્વારા મળેલા નીચા સફળતા દર અને ઉંચા ઉત્પાદન ખર્ચ દ્વારા તેને વેગ મળ્યો છે. તેમ છતાં, કાદવ કરચલાના ઉછેરની ઉત્પાદકતા અને નફાકારકતા સમાન એકમ વિસ્તારના ઝીંગા ઉછેર કરતા ઓછી હશે, વ્યવસ્થિત કાદવ કરચલાની ઉછેર જોખમ અને સંચાલન સરળતાના સ્તરમાં ઓછો છે. કાદવ કરચલાનો ઉછેર પણ ભાંભરાપાણીના જળચરાંછેરમાં વિવિધતા માટેનો વિકલ્પ છે અને વધુ પર્યાવરણીય ટકાઉપણાની પ્રશંસા કરે છે. ગુજરાત રાજ્યમાં ભાંભરાપાણી અને નીચાણવાળી ખારાશગ્રસ્ત જમીનનો વિપુલ પ્રમાણમાં સોત છે જેનો મોટાબાગે ઝીંગા ઉછેર માટે ઉપયોગ કરવામાં આવે છે. કાદવ કરચલા ઉછેર એ ગુજરાતમાં ઝીંગા ઉછેર માટે પૂરક ઉછેરની પ્રથા હોઈ શકે છે, ખાસ કરીને ઝીંગામાં નિષ્ણળતાવાળા પ્રદેશો અને એવા ખેડૂતો કે જેઓ મોટા પાયે રોકાણ કરવામાં સક્ષમ નથી અને તેમ છતાં નોંધપાત્ર આવક પ્રાપ્ત કરવા ઈચ્છે છે. કાદવ કરચલા ઉછેર પદ્ધતિઓમાં સરળતા અને ઓછી રોકાણ આવશ્યકતાઓને કારણે દરિયાકાંઠાના આદિજાતિ સમુદ્દરાયો માટે એક ઉત્તમ વૈકલ્પિક આજીવિકા વિકલ્પ છે.



સીયલા સેરાટા



સીયલા ઓલિવાસીયા



ભારતીય કાંઈના પાણીમાં કાદવના કરચલાની બે પ્રજાતિઓ ઉપલબ્ધ છે, જે સીયલા એટલે કે વિશાળ કાદવ કરચલો, સીયલા સેરાટા અને ઓરેન્જ કાદવ કરચલો, સીયલા ઓલિવાસીયા, જે નિયંત્રિત પરિસ્થિતિઓમાં ઉછેર કરી શકાય છે. દરિયાકાંઈના ગુજરાતમાં ઇચ્છુરિન અને કીક સિસ્ટમ્સકારા એસ. ઓલિવાસીયા પ્રભુત્વ ધરાવે છે. એસ. સેરાટા ભારતના દક્ષિણ પૂર્વના દરિયાકાંઈ પુષ્ટ પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેમાં તે જળચરણને ઉદ્યોગ માટે નિકાસ વેપાર અને બીજ સ્ટોક માટે વધારે માધીમારીના દબાણને આધિન છે. ઉછેર માટે કાદવ કરચલો જુવેનાઈલ (એસ. સેરાટા) ના અતિશય જંગલી સંગ્રહને પરિણામે ઘણા શેરોમાં ઘટાડો થયો છે જેનાથી બીજની ઉપલબ્ધતા અને ઉંચી કિંમત ઓછી થઈ છે. જો કે, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કેટલાક ભાગોમાં જ્યાં કાદવ કરચલાના જંગલી શેરોમાં એસ ઓલિવાસીયાનો દબદબો છે, જળચરણને ઉદ્યોગ લગાભગ આ પ્રજાતિનાઉછેર પર ખીલે છે. રાજ્યમાં કાદવ કરચલાનાઉછેરનું ભાવિ આ પ્રજાતિ દ્વારા વર્યસ્વ ધરાવતું હશે. ગુજરાતમાં પણ એસ ઓલિવાસીયાના વિપુલ સંસાધનો છે.

## બીજ

એસ. સેરાટાના બીજ ઉત્પાદન માટે હેચરી ટેકનોલોજી અસ્તિત્વમાં છે. હેચરી કરચલા ઇન્સ્ટર્સ (CW ૦.૫-૧.૦ સે.મી.) અથવા કરચલા જુવેનાઈલ (CW ૪-૫ સે.મી., BW ૩-૫ ગ્રામ) સપ્લાય કરવામાં સક્ષમ છે. નાના કદના બીજનો ઉછેર નર્સરી ઉછેર દ્વારા અને પૂર્વ વૃદ્ધિ પાલનને આધિન કરવું પડે છે જેથી તળાવમાં સ્ટોકિંગ માટે યોગ્ય ૫૦૦-૧૦૦ ગ્રામ કરચલો જુવેનાઈલ મેળવી શકાય. વૈકલ્પિકરૂપે, ભારતીય દરિયાકિનારે કાદવ કરચલા માધીમારીમાંથી મેળવેલ જંગલી પકડેલા એસ સેરાટા જુવેનાઈલસ (૫૦-૧૦૦ ગ્રામ) કાદવ કરચલા ઉછેરના તળાવમાં સ્ટોકિંગ મટિરિયલ તરીકે ઉપયોગ કરી શકાય છે. ઓ. ઓલિવાસીયા માટે વ્યવસાયિક હેચરીઓ અસ્તિત્વમાં નથી અને પ્રજાતિના બીજને કાદવ કરચલાની માધીમારીથી સંપૂર્ણ રીતે કાઢવામાં આવે છે. એસ. ઓલિવાસીયાના વિપુલ સંસાધનો ગુજરાતમાં અસ્તિત્વમાં હોવાથી, સ્થાનિક માધીમારીમાંથી બીજ મેળવી શકાય છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારતની આસપાસ કાદવના કરચલાના બીજના વેપાર અને પરિવહન સાથે સંકળાયેલા મોટા બજારો અસ્તિત્વમાં છે. તામિલનાડુના ચેજાઈમાં ચિન્તાદૂપિત ખાતે જળચરણને ઉદ્યોગ અને નિકાસ વેપાર બંને માટે કાદવ કરચલાનું મોટું બજાર



### ઉછેર પદ્ધતિઓ

કાદવના કરચલાના જળચરઉછેરમાં ઘણી ઉછેર પદ્ધતિઓનો સમાવેશ થાય છે જેમ કે ફેટનિંગ, મોનોકલ્ચર, ભાંભરાપાણીની માઇલી સાથે કાદવ કરચલાનું પોલિકલ્ચર, બોક્સ કલ્ચર અને નરમ શેલવાળા કરચલાઓના ઉત્પાદન માટે રીક્યુલેટરી એકવાકલ્ચર સિસ્ટમ્સ. વિવિધ ઉછેર પ્રણાલીમાં, એસ.સેરાટાની પોલિકલ્ચર, ભાંભરાપાણીની માઇલી અને એસ ઓલિવાસીયા / એસ. સેરાટાની બોક્સ કલ્ચર, તેના સ્થાન, ઉછેરની સ્થિતિ, બજારો અને બીજની ઉપલબ્ધતાના આધારે માત્ર ગુજરાતને સંબંધિત છે.

### પોલીકલ્ચર, ભાંભરાપાણીની માઇલી સાથે એસ.સેરાટા

મિલ્કફિશ, ચાનોસ ચાનોસ સાથે એસ. સેરાટાનું પોલીકલ્ચર, દરિયાકાંઠાના ગુજરાતમાં કાદવ કરચલાના જળચરઉછેર માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ હશે, જેમાં હાયપર ક્ષારયુક્ત પરિસ્થિતિઓનો વ્યાપકપણે સામનો કરવો પડે છે. મિલ્કફિશ ઉચ્ચ ક્ષારયુક્ત પરિસ્થિતિઓમાં ઉચ્ચ સહિષ્ણુતા દર્શાવે છે અને આવી શરતોમાં પણ ઝડપી વૃદ્ધિ દર દર્શાવે છે. ઓલિવાસીયાની પોલીકલ્ચરની ભલામણ કરવામાં આવતી નથી, કારણ કે તેની તીવ્ખ બુરોઈંગ ટેવ ડાઇક્સને નુકસાન પહોંચાડે છે અને લણણી પ્રક્રિયાને વધુ જટિલ બનાવે છે.



માધ્યલી અને ઝીંગાનું આદર્શ બહુપાલન મોડેલ :  
ગુજરાત રાજ્યનો અમિંગમ



### તળાવની ડિઝાઇન બાબતો

હાલના ઝીંગા તળાવો અથવા નવા બાંધવામાં આવેલા તળાવોનો ઉપયોગ એસ સેરાટાના પોલીકલ્યર માટે થઈ શકે છે. લંબચોરસ અથવા ચોરસ તળાવનો ઉપયોગ કાદવ કરચલાનો ઉછેર માટે થઈ શકે છે, જોકે લંબચોરસ તળાવો તેમની સૌથી લાંબી બાજુ સ્થાનિક પવનની સ્થિતિ સાથે ગોઠવાયેલા વાયુની જરૂરિયાતોને ઘટાડે છે. ૦.૫ થી ૧.૦ એકરનો તળાવ (૨૦૦૦-૪૦૦૦ એકમ) માધ્યલી અને કાદવના કરચલાના પોલીકલ્યર માટે યોગ્ય છે. કરચલાઓને નીકળી જતા બચાવવા માટે ડાઇક કિનારીઓ પર ઢ્રેકા વાંસ અથવા કસુઆરીના લાકડાથી સુરક્ષિત ૮૦-૧૨૦ gsm પ્લાસ્ટિક ફિલ્મ (૨-૩ કુટ લાંબી) નો ઉપયોગ કરીને ફેન્સિંગ આપવામાં આવે છે. વધારામાં, તળાવનો એક ભાગ એચડીપીઇ નેટિંગ અથવા પીવીસી જાળીનો ઉપયોગ કરીને તળાવના તળિયે કસુઆરીના લાકડાનો ઉપયોગ કરીને એક પેન જેવી રચના કરે છે જેમાં કાદવના કરચલા ઉછેરવામાં આવે છે તેનો ઉપયોગ કરીને બાકીના તળાવથી અલગ થઈ શકે છે. બંને ફેન્સિંગ સામગ્રી ઓછામાં ઓછી ૨૦-૩૦ સે.મી.ની ઉંડાઈ સુધી જમીનમાં ચાલુ રહે છે તેની ખાતરી કરવી જોઈએ.

## પાણીની ઉંડાઈ અને ઉંડરની સ્થિતિ

તળાવમાં પાણીની ઉંડાઈ ૮૦ સે.મી. કરતા ઓછા ના સ્તરે જાળવવામાં આવશે અને પાણીની ઉંડાઈ ૧૫૦ સે.મી.થી વધુ ન હોવી જોઈએ. કાદવ કરચલો જુવેનાઈલ (GL કદ  $<350\text{ગ્રામ}$ ) ની પેન અંદર ૦.૫-૧.૦ બ્યક્ઝિટિગત પ્રતિએકમની ઘનતા પર સ્ટોક કરી શકાય છે અને ઘનતાની ગણતરી તળાવ ક્ષેત્રના આધારે નહીં, પેન ક્ષેત્રના આધારે કરવામાં આવે છે. કરચલાની નરભક્ષમતાને ઘટાડવા, સંતાવાની જગ્યા પૂરી પાડવા માટે જુના પીવીસી પાઈપો (૧૧૦મીમી અને તેથી વધુ), સિમેન્ટના પાઈપો, ટાઇલ્સ જેવા માળખાં પેનમાંઆપવામાં આવે છે. આ માળખાં સ્ટોક જુવેનાઈલ ની કુલ સંખ્યાના ૫૦% ના દરે પૂરા પાડવામાં આવે છે. જળાશયોમાંથી પાણીનો ઉપયોગ કરીને તળાવોમાં પાણીનું સ્તર ટોચ પર લાવી શકાય છે. કુલ તળાવના જથ્થાના ૨૦-૩૦% ના દરે પાણીની ગુણવત્તાના





માધ્યલી અને ઝીંગાનું આદર્શ બહુપાલન મોડેલ :  
ગુજરાત રાજ્યનો અમિંગમ



વિશ્લેષણના આધારે ૩૦-૪૫ દિવસમાં એકવાર જળ વિનિમય કરવામાં આવે છે. નર્સરીમાં ઉછેરવામાં આવતી મિલ્કફિશ (TL પથી ૭ સે.મી., શરીરનું વજન ~ ૧-૨ ગ્રામ) અથવા મોટા કદના બીજને તળાવના ક્ષેત્રમાં ૨૦૦૦ એકમીઠ ૧૦૦૦ નંગાથી ૧૫૦૦ નંગાના દરે તળાવમાં સ્ટોક કરી શકાય છે. મિલ્કફિશને કરચલાના બીજનો સંગ્રહ કર્યાના ૧૫ દિવસ પછી અથવા કાદવ કરચલાના જીવેનાઈલ્સ સ્ટોક કરતા ૩૦ દિવસ પહેલાં સ્ટોક કરવામાં આવે છે.



## ખોરાક

એસ. સેરાટા માટે વ્યવસાયિક ફોર્મ્યુલેટેડ ફીડ ઉપલબ્ધ નથી, તેમ છતાં ICAR-CIBAપાસે વિશેષ ફોર્મ્યુલેટેડ કરચલા ફીડ ઉપલબ્ધ છે જે શ્રેષ્ઠ પરિણામો આપી રહ્યું છે. વ્યવસાયિક કાદવ કરચલાજળચરઉછેરખોરાક માટેલેન્ડિંગ કેન્દ્રો અથવા અન્ય જળ સંસ્થાઓમાંથી મેળવેલ ઓછી કિંમતી મૃત નકામી માછલી પર આધારિત છે. ભીની અથવા સૂકી મૃત નકામી માછલીનો ઉપયોગ વૈકલ્પિક દિવસોમાં શરીરના વજનના ૫-૮% દરે કરચલાઓને આપવામાટે કરવામાં આવે છે, એટલે કે બે દિવસમાં ફક્ત એક જ વાર ખોરાક આપવામાં આવે છે. જો કે, વધુ સ્ટોકિંગ ઘનતાના કિસ્સામાં, દરરોજ ખોરાક આપવામાં આવે છે. પ્રાધાન્ય મોડી સાંજે અથવા વહેલી સવારના કલાકો દરમ્યાન એક જ ફીડિંગ સેશનમાં આખા ખોરાકનું પ્રસારણ થઈ શકે છે. તિલાપિયા, દરિયાઈ ઇલ, સારડીન અને અન્ય નીચા મૂલ્યની દરિયાઈ માછલી કાદવ કરચલાના જીવેનાઈલ માટે ઉત્તમ ખોરાક છે. સ્ટોકિંગના ૩૦દિવસથી શરીરના વજનના ૨-૩% ના દરે સીબાનું ઓછી કિંમતનું ફીડ પોલી પલસ અથવા અન્ય વેપારી કાર્પ / કેટફિશ ફીડનો ઉપયોગ કરીને મિલ્કફિશને ખવડાવી શકાય છે.





માધ્યલી અને ઝીંગાનું આદર્શ બહુપાલન મોડેલ :  
ગુજરાત રાજ્યનો અમિંગમ



### લણણી

જ્યારે ૫૦-૧૦૦ ગ્રામ કદના એસ સેરાટા જીવેનાઈલ સ્ટોક કરવામાં આવે છે, ત્યારે કલની લણણી ૪ મહિનાથી શરૂ થશે, જેમાં મોટા કદના કરચલા ( $>500$  ગ્રામ) બાઇટડ ટ્રેપ્સનો ઉપયોગ કરીને લણણી કરવામાં આવશે. આ દર ૧૫ દિવસમાં એકવાર ૫-૮ મહિના સુધી ચલાવી શકાય છે, જેના પગલે સંપૂર્ણ સ્ટોક લણણી કરી શકાય છે. મિલ્કફિશના કિસ્સામાં, કરચલાના જીવેનાઈલ ને સ્ટોક કરતા ૩૦ દિવસ પહેલા ફિંગરલિંગ્સ સ્ટોક કરવાની ભલામણ કરવામાં આવે છે જેમ કે માધ્યલીને ૭-૮ મહિનાની વધતી મોસમ સાથે પૂરી પાડી શકાય છે.







### ઉત્પાદન અને અર્થશાસ્ત્ર

મિલ્કફિશ સાથે એસ. સેરાટાનું પોલીકલ્બર એ એક ટકાઉ વ્યવસાયિક મોડેલ છે. એસ. સેરાટા અને મિલ્કફિશ માટે લણણીનો બચાવદર સામાન્ય રીતે અનુકૂળ પ્રેરણ ૫૫-૬૦% અને ૮૦-૧૦૦% છે. ૧૦૦૦ એકમપેનવાળા ૨૦૦૦એકમતળાવ માટે ૫૦૦એસ. સેરાટા જુવેનાઇલ અને ૧૨૦૦મિલ્કફિશ ફિંગરલિંગ્સ સ્ટોક કરવામાં આવ્યા છે, લણણી વખતે સરેરાશ અસ્તિત્વ અને કદ (એસ. સેરાટા - ~ ૫૦૦ગ્રામ, મિલ્કફિશ ~ ૪૦૦ગ્રામ), ૧૦૦કિલોગ્રામ કાદવ કરયાંનો અને ૪૮૦ કિલો માધ્યલીઉત્પાદન સરળતાથી પ્રાપ્ત છે. વધુમાં, કેટલાક ઝીંગા (૫૦૦૦-૭૫૦૦ PL) અને સીબાસ (૧૦-૧૫ નંગા, ~ ૫૦ગ્રામ કદ) બીજ પણ સ્ટોક કરી શકાય છે, જેના પરિણામે ૫૦કિલો ઝીંગા અને ૧૦કિલો સીબાસનું ઉત્પાદન થઈ શકે છે. આ એકમ વિસ્તાર (૨૦૦૦એકમ) ની રૂ. ૨.૫-૨.૮ લાખની આવકમાં રૂ. ૧.૬ થી ૨.૧લાખ / ઉછેરનો ચોખ્મો લાભ રૂ. ૪૦,૦૦૦થી ૬૦,૦૦૦ઉછેર દીઠ (કોષ્ટક ૧)





**ક્રોષ્ક ૧: ૨૦૦૦ એકમ કાદવ કરચલા પોલિકલ્યર તળાવના અર્થશાસ્ત્રમાં ૫૦૦ કાદવ કરચલા (સિયલા સેરાટા), ૧૨૦૦ મિલ્કફિશ, ૭૫૦૦ પેનીઅસ ઇન્ડીક્સ અને ૧૫ સીબાસ જુવેનાઇલ નો સ્ટોક છે**

મૂડી રોકાણ	રકમ (રૂ.)
તળાવ બાંધકામ	૨૫,૦૦૦
પંપ, એન્જિન, પાઇપલાઇન્સ અને મોટર્સ	૨૫૨૦૦
એરેટર	૨૭,૦૦૦
વિદ્યુત લાઇનો અને સર્કિટ	૫,૦૦૦
ફાર્મ ટ્રલ્સ અને એસેસરીઝ	૪,૫૦૦
<b>કુલ મૂડી રોકાણ</b>	<b>૮૮,૯૦૦</b>
<b>નિશ્ચિત ખર્ચ</b>	<b>રકમ (રૂ.)</b>
લીઝ મૂલ્ય / ભાડામૂડી	૧,૦૦૦
રોકાણ પર અવમૂલ્યન	૮,૫૭૦
મૂડી રોકાણ પર વ્યાજ	૬,૬૩૬
સમારકામ અને જાળવણી	૫,૦૦૦
<b>કુલ નિશ્ચિત ખર્ચ</b>	<b>૨૧,૫૦૬</b>
<b>ચલ ખર્ચ</b>	<b>રકમ (રૂ.)</b>
તળાવની તૈયારી	૧૦,૦૦૦
કાદવ કરચલાના બીજની કિંમત (૫૦૦ નંગા ~૪૨ કિલો @ રૂ. ૭૦૦ / કિગ્રા)	૨૮,૪૦૦
મિલ્કફિશ ફિંગરલિંગ (૧૨૦૦ નંગા @ રૂ. ૮ / બીજ) ની કિંમત	૮,૫૦૦
સીબાસ જુવેનાઇલની કિંમત (૧૫ નંગા @ રૂ. ૭૦ / બીજ)	૧,૦૪૦
પેનીઅસ ઇન્ડીક્સ પીએલ (૭૫૦૦ નંગા @ રૂ. ૦.૭ / પીએલ) ની કિંમત	૪,૫૦૦
શ્રેષ્ઠ માછલી (૫૨૫ કિગ્રા @ રૂ. ૫૦ / કિગ્રા)	૩૧,૫૦૦
મિલ્કફિશ માટેનો ખોરાક (સીબા પોલીપ્લસ @ ૩૫ / કિગ્રા માટે રૂ. ૮૬૪ / કિગ્રા)	૩૦,૨૪૦
ખાતર	૨,૦૦૦
રસાયણો	૧૨,૫૦૦
બળતણ અને વીજળી ચાર્જ	૬,૫૦૦
ફેન્સિંગ	૩૦,૦૦૦
<b>મજૂર</b>	<b>૧૭,૫૦૦</b>



માધ્યલી અને ઝીંગાનું આદર્શ બહુપાલન મોડેલ :  
ગુજરાત રાજ્યનો અભિગમ



લણણી ખર્ચ	3,000
પરિવહન	3,000
પરચુરણ કુલ	2,400
ચલ કિંમત	9,65,260
<b>કુલ વળતર</b>	
કુલ ઉપજ: મિલ્કફિશ	80 કિલો
દર / કિલો: મિલ્કફિશ	રૂ. 120 કિલો
કુલ ઉપજ: કાદવ કરચલો	120 કિલો
દર / કિલો: કાદવ કરચલો	રૂ. 1400 કિલો
કુલ ઉપજ: સીબાસ	14 કિલો
દર / કિલો: સીબાસ	રૂ. 400 કિલો
કુલ ઉપજ: ઝીંગા	40 કિલો
દર / કિલો: ઝીંગા કુલ	રૂ. 300 કિલો
<b>વળતર</b>	
<b>આર્થિક પરિમાણો</b>	
કુલ સ્થેર વળતર	2,48,200
કુલ નિશ્ચિત ખર્ચક	21,505
દુલ ચલ કિંમત	9,65,260
કુલ ખર્ચ	2,17,865
TC પર ચોખ્યું વળતર	40,308
TVC પર ચોખ્યું વળતર	51,610
TC પર BCR	9.98
TVC પર BCR	9.39
મૂડી રોકાણા TCના આધારે વળતરનો દર	18.46%
મૂડી રોકાણા TVC આધારે વળતરનો દર	20.43%
<b>કુલ આવક (રૂ. / હેક્ટર / પાક)</b>	<b>2,01,420</b>

## ભાંભરા પાણીમાં જળચરઉછેર થકી ખોરાક, રોજગાર અને સમૃદ્ધિ



વધુ માહિતી માટે સંપર્ક કરવો

### નિયામક

આઈસીએઓએસ - કેન્દ્રીય ખારા જલજીવ પાલન અનુસંધાન સંસ્થા

(ભારતીય ફુષ્ટ સંશોધન પરિષદ)

# 75 સેન્ટોમ હાઇ રોડ, એમ.આર.સી નગર,

ચென்னை, தமிழ்நாடு - 600 028

Phone : +91 44 24618817, 24616948, 24610565

Fax : 9144 2461 0311

Web: [www.ciba.res.in](http://www.ciba.res.in)

E-mail : [director@ciba.res.in](mailto:director@ciba.res.in)

